

M.Com Semester - 2 (CBCS) Examination
March/April – 2024 (As Per Syllabus Year-2018)
Corporate Financial Reporting (CORECOURSE)

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન-૧ તા. 31-12-2023નાં રોજના X લિ. અને Y લિ. નાં પાકા સરવૈયા છે. તેના પરથી સમાન કદનું (૨૦)
 પત્રક બનાવી નાણાકીય વિવેચન કરો.

જવાબદારીઓ	X લિ. (રૂ.)	Y લિ. (રૂ.)	મિલકતો	X લિ. (રૂ.)	Y લિ. (રૂ.)
ઈક્વિટી શેરમૂડી	6,00,000	10,00,000	કાયમી મિલકતો	2,00,000	6,00,000
પ્રેફરન્સ શેરમૂડી	1,00,000	1,00,000	ચાલુ મિલકતો	2,00,000	1,00,000
સામાન્ય અનામત	60,000	1,50,000	રોકાણો	82,000	60,000
નફા-નુકસાન ખાતું	1,20,000	1,50,000	આખર સ્ટોક	1,50,000	2,00,000
લેણદારો	50,000	60,000	દેવાદારો	1,00,000	2,00,000
દેવીહૂડી	2,000	4,000	રેકડ-બેંક	2,00,000	3,04,000
	9,32,000	14,64,000		9,32,000	14,64,000

અથવા

પ્રશ્ન-૧ મહેશ લિ. ની નીચેની માહિતિ પરથી પાકુ સરવૈયું તૈયાર કરો.

સ્ટોક ચલનદર(વેચેલ માલની પડતર/આખર માલનો સ્ટોક)	6 વખત
કાચા નફાનો ગુણોતર	20%
ચાલુ ગુણોતર	2.5
પ્રવાહી ગુણોતર	1.5
કાર્યશીલ મૂડી	રૂ. 7,50,000
કાયમી મિલકતનાં ઉથલાનો ગુણોતર (વેચેલ માલની પડતર સાથે)	2 વખત
સરેરાશ ઉધરાણીની મુદત (વર્ષના 360 દિવસો)	60 દિવસ
કાયમી મિલકતો સાથે શેરહોલ્ડર્સનાં ભંડોળનું પ્રમાણ	0.80:1
અનામત અને વધારા સાથે મૂડીનું પ્રમાણ	0.50:1
લાંબાગાળાની લોન સાથે શેરહોલ્ડર્સનાં ભંડોળનું પ્રમાણ	0.20:1

તા. 31-03-2024નાં રોજ પુરા થતા વર્ષનું આવક પત્રક

વિગત	રકમ રૂ.	વિગત	રકમ રૂ.
વેચાણ પડતર:-		વેચાણ	2,85,000
શરૂ સ્ટોક(ફિફો) 57,000			
ઉમેરો: ખરીદી 1,14,000			
1,71,000			
બાદ: આખર સ્ટોક(ફિફો) 19,000	1,52,000		
કાયો નફો	1,33,000		
	2,85,000		2,85,000
સંચાલન ખર્ચ	38,000	કાયો નફો	1,33,000
ધસારો:-			
પ્લાન્ટ પર 10,000			
મકાન પર 9,000	19,000		
વ્યાજ ચુકવ્યું	9,500		
ચોખ્ખો નફો	66,500		
	1,33,000		1,33,000

તા. 31-03-2023 નાં રોજનું પાકુ સરવૈયું

જવાબદારીઓ	રૂ.	મિલકતો	રૂ.
શેરમૂડી	1,90,000	પ્લાન્ટ	1,00,000
લોન	47,500	મકાન	90,000
લેણદારો	60,000	સ્ટોક	57,000
દેવીહૂંડી	6,500	દેવાદારો	34,200
		રોકડ-બેંક	22,800
	3,04,000		3,04,000

દેવાદારો, લેણદારો અને દેવીહૂંડીની બાકીઓ વર્ષ દરમિયાન સમાન રહે છે. વ્યાજ વર્ષના છેલ્લા દિવસે ચૂકવેલ છે.

સામાન્ય ભાવનાં સુચંકાંક નીચે મુજબ હતા:-

તા. 31-03-2023નાં રોજ 230

વર્ષ દરમિયાન સરેરાશ 276

તા. 31-03-2024નાં રોજ 345

ઉપરોક્ત માહિતિ પરથી વર્તમાન ખરીદ શક્તિ(CPP) પધ્ધતિથી આવક પત્રક અને પાકુ સરવૈયું તૈયાર કરો.

અથવા

પ્રશ્ન-૨ (A) નીચેની માહિતી પરથી વેચાણ પડતર હવાલા(COSA)ની ગણતરી કરો. (૦૫)

શરૂઆતનો સ્ટોક તા. 1-1-2023	રૂ. 1,20,000
આખર સ્ટોક તા. 31-12-2023	રૂ. 1,60,000
તા. 1-1-2023નો સુચક આંક	160
તા. 31-12-2023નો સુચક આંક	200
વર્ષનો સરેરાશ સુચક આંક	190

(B) નીચેની માહિતી પરથી નાંણાકીય કાર્યશીલમૂડી હવાલા(MWCA)ની ગણતરી કરો. (૦૫)

વિગત	શરૂઆતની બાકી	આખરની બાકી
લેણાંના ખાતા	રૂ. 18,000	રૂ. 21,000
દેવાનાં ખાતા	રૂ. 10,000	રૂ. 12,000
ભાવાંક	175	205

સરેરાશ ભાવાંક 190

(C) એક કંપનીના ચોપડામાંથી નીચેની માહિતિ પ્રાપ્ત થાય છે. (૧૦)

વિગત	શરૂઆતની બાકી (રૂ.)	આખરની બાકી (રૂ.)
ઈક્વિટી શેરમૂડી	5,00,000	5,00,000
અનામત અને વધારો	3,00,000	3,65,000
તારણવાળી લોન	3,00,000	2,35,000
કરવેરાની જોગવાઈ	50,000	40,000
રોકડ અને બેંક	80,000	50,000
ડિબેંચર્સ	2,00,000	2,00,000

સ્થિર મિલકતોમાં શરૂઆત અને વર્ષનાં અંતે રૂ. 3,30,000 અને રૂ. 5,10,000 નો અનુક્રમે વધારો થયેલ છે.

અન્ય માહિતિ નીચે મુજબ છે:

વેચાણ પડતર હવાલો	82,000
ઘસારા હવાલો	28,000
નાંણાકીય કાર્યશીલ મૂડીનો હવાલો	40,000

ગિયરીંગ હવાલાની ગણતરી કરો.

પ્રશ્ન-૩ વિજય લી. ના ચોપડામાંથી તા. 31-03-2024નાં રોજ પુરા થતા વર્ષની મેળવેલ માહિતિ નીચે મુજબ છે. (૧૫)

વિગત	રકમ (રૂ.)
વેચાણ	60,00,000
તૈયાર માલનો શરૂઆતનો સ્ટોક	4,80,000
તૈયાર માલનો આખરનો સ્ટોક	5,76,000
કાચા માલનો શરૂઆતનો સ્ટોક	2,04,000
કાચા માલનો આખરનો સ્ટોક	2,56,800
કાચા માલની ખરીદી	24,00,000
પગાર અને મજૂરી	15,12,000
એજન્ટને કમિશન	48,000
પેકિંગ ખર્ચ	24,000
જાહેરાત ખર્ચ	60,000

તાર ટપાલ ખર્ચ	33,600
મજૂર કલ્યાણ ખર્ચ	3,79,200
મેનેજર પગાર	2,01,600
વ્યાજ ચૂકવ્યું	43,200
ધસારો	1,32,000
કરવેરા	2,40,000
એક્સાઈઝ ડ્યૂટી	28,800

ઉપરની માહિતી પરથી મૂલ્ય વૃદ્ધિનું પત્રક તૈયાર કરો.

અથવા

પ્રશ્ન-૩ આર્થિક મૂલ્યવૃદ્ધિ અને બજારમૂલ્ય વૃદ્ધિ વિશે સમજાવો.

પ્રશ્ન-૪ કંપનિલક્ષી નાંણાકીય અહેવાલ પ્રેષણનો અર્થ અને ફાયદા સમજાવો.

(૧૫)

અથવા

પ્રશ્ન-૪ નાંણાકીય અહેવાલ પ્રેષણ માહિતિનું ગુણવત્તાયુક્ત લાક્ષણિકતાઓ સમજાવો.

ENGLISH VERSION

Que-1 Criticize financially by preparing Equal size statement. Balance sheets of X Ltd. and Y Ltd. as on 31-12-2023. (20)

Liabilities	X Ltd. (Rs.)	Y Ltd. (Rs.)	Assets	X Ltd. (Rs.)	Y Ltd. (Rs.)
Equity share capital	6,00,000	10,00,000	Fixed assets	2,00,000	6,00,000
Preference share capital	1,00,000	1,00,000	Current assets	2,00,000	1,00,000
General reserve	60,000	1,50,000	Investment	82,000	60,000
Profit & Loss A/c	1,20,000	1,50,000	Closing stock	1,50,000	2,00,000
Creditors	50,000	60,000	Debtors	1,00,000	2,00,000
Bills payable	2,000	4,000	Cash-Bank	2,00,000	3,04,000
	9,32,000	14,64,000		9,32,000	14,64,000

OR

Que-1 Prepare balance sheet from the following information of Mahesh Ltd.

Stock Turnover(Cost of sales/closing stock)	6 Times
Gross profit Ratio	20%
Current Ratio	2.5
Liquid Ratio	1.5
Working Capital	Rs. 7,50,000
Fixed Assets Turnover Ratio(with cost of sales)	2 Times
Average Collection period(Annual 360 days)	60 Days
Proportion of shareholder's fund with fixed assets	0.80:1
Proportion of capital with Reserve and surplus	0.50:1
Proportion of shareholder's funds with long term Loan	0.20:1

Que-2 Following are the income statement and balance sheet of the ABC Limited income statement for the year ended 31st March 2024. (20)

Particulars	Amt. (Rs.)	Particulars	Amt. (Rs.)
Cost of Sales:-		Sales	2,85,000
Opening stock(FIFO) 57,000			
Add: Purchases 1,14,000			
1,71,000			
Less: Closing stock(FIFO) 19,000	1,52,000		
Gross Profit	1,33,000		
	2,85,000		2,85,000

Operating Expenses	38,000	Gross Profit	1,33,000
Depreciation:-			
Plant 10,000			
Building <u>9,000</u>	19,000		
Interest paid	9,500		
Net Profit	66,500		
	1,33,000		1,33,000

Balance sheet as at 31st March, 2023

Liabilities	Rs.	Assets	Rs.
Share capital	1,90,000	Plant	1,00,000
Loan	47,500	Building	90,000
Creditors	60,000	Stock	57,000
Bills payable	6,500	Debtors	34,200
		Cash & Bank	22,800
	3,04,000		3,04,000

The balances of creditors, Bills payable and Debtors Remain the same during the year. Interest were paid the last day of the year of the year.

The general price Indices were as follows:-

As on 31 st March 2023	230
Average During the year	276
As on 31 st March 2024	345

You are required to restate the income statement and balance sheet as per current purchasing power(CPP) method.

OR

Que-2 (A) Determine the value of cost of sales adjustment from the data given below. (05)

Opening stock 01-01-2023	Rs. 1,20,000
Closing stock 31-12-2023	Rs. 1,60,000
Index number 1-1-2023	160
Index number 31-12-2023	200
Average Index number during the year	190

(B) Calculate monetary working capital Adjustments(MWCA) from the following information. (05)

Particulars	Opening Balance	Closing Balance
Account Receivable	Rs. 18,000	Rs. 21,000
Account Payable	Rs. 10,000	Rs. 12,000
Price Index	175	205

Average Price Index 190

(C) Following information is available from the books of a company. (10)

Particulars	Opening Balance (Rs.)	Closing Balance (Rs.)
Equity share capital	5,00,000	5,00,000
Reserves & surplus	3,00,000	3,65,000
Secured Loan	3,00,000	2,35,000
Provision for tax	50,000	40,000
Cash & Bank	80,000	50,000
Debentures	2,00,000	2,00,000

Fixed Assets are increased by Rs. 3,30,000 and Rs. 5,10,000 at the beginning and at the end of the year Respectively.

Other Information:

Cost of sales adjustment	82,000
Depreciation adjustment	28,000
Monetary working capital adjustment	40,000

Calculate gearing adjustments.

Que-3 Following information is obtained from the books of Vijay Ltd. for the year ended on 31-03-2024.

(15)

Particulars	Amt. (Rs.)
Sales	60,00,000
Opening stock finished goods	4,80,000
Closing stock of finished goods	5,76,000
Opening stock of Raw material	2,04,000
Closing stock of raw material	2,56,800
Raw material purchase	24,00,000
Salary and wages	15,12,000
Agent commission	48,000
Packing Expenses	24,000
Advertisement Expenses	60,000
Postage-Telephone Exp.	33,600
Workers welfare Expenses	3,79,200
Manager salary	2,01,600
Interest paid	43,200
Depreciation	1,32,000
Income tax	2,40,000
Excise duty	28,800

Prepare value added statement from the above information.

OR

Que-3 Explain about Economic value added and market value added.

Que-4 Explain the meaning and advantages of corporate financial reporting.

(15)

OR

Que-4 Explain qualitative characteristics of financial reporting information.
